

ગૂડ્ઝ ટ્રેન પાછળથી કાંચનજંગા એક્સપ્રેસને ટકરાઈ

બંગાળમાં બે ટ્રેનો વચ્ચે અકસ્માત સર્જાતાં ૧૫નાં મોત, ૬૦ને ઈજા

પીટીઆઈ ન્યુ જલપાઈગુડી/કોલકાતા, તા. ૧૭

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જીએક ગુડ્ઝ ટ્રેન ટકરાતાં સોમવારે સીયાલ્હાહ જઈ રહેલી કાંચનજંગા એક્સપ્રેસના પાછળના ૩ કોચ પાટા પરથી ઊતરી જતાં ઓછામાં ઓછા ૧૫ પ્રવાસીઓનાં મોત નીપજ્યાં હતાં અને અન્ય ૬૦ને ઈજા થઈ હતી. જનહાનિના આંકડા હજુ વધી શકે

છે. રાજ્ય સરકાર અને કેન્દ્રની ઘણી એજન્સીઓ સ્થાનિકો સાથે મળીને પેસેન્જરોને બચાવવાના કાર્યમાં લાગી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

મૃતકોમાં ગુડ્ઝ ટ્રેનના પાર્ઠલટ અને કો-પાર્ઠલટ તથા પેસેન્જર ટ્રેનના ગાર્ડનો સમાવેશ થાય છે, એમ એક સિનિયર રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું. ઈજાગ્રસ્તોને નોર્થ બંગાલ મેડિકલ

કોલેજ એન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યાં છે. ઉત્તર બંગાળના ન્યૂ જલપાઈગુડી સ્ટેશનથી આશરે ૩૦ કિલોમીટરના અંતરે રંગાપાની સ્ટેશન નજીક ગુડ્ઝ ટ્રેનનું લોકોમોટિવ પાછળથી ટકરાતાં તેના કારણે પાછળના ૩ કમ્પાર્ટમેન્ટ્સ પાટા પરથી ઊતરી ગયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું

હતું કે, પશ્ચિમ બંગાળનો રેલ્વે અકસ્માત દુઃખદ છે. પ્રિયજનો ગુમાવનારા લોકોને હું સાંત્વના હું પ્રાર્થના કરું છું કે, ઈજાગ્રસ્ત લોકો વહેલી તકે સાજા થઈ જાય. અધિકારીઓ સાથે મેં વાત કરી છે અને સ્થિતિની સમીક્ષા કરી છે. અસરગ્રસ્તોને બચાવી લેવા માટે રેસ્ક્યૂ ઓપરેશન્સ ચાલી રહ્યાં છે, એમ મોદીએ જણાવ્યું હતું.

સ્કાય એરે રોકાણકારો પાસેથી ૪ મિલિયન યુએસ ડોલર પ્રાપ્ત કર્યા

પીટીઆઈ

નવી દિલ્હી, તા. ૧૭
ડ્રોન પરિવહન ઉકેલ પૂરી પાડતી સ્કાય એરે આજે જણાવ્યું હતું કે તેણે ૪ મિલિયન ડોલરનું ભંડોળ પ્રાપ્ત કર્યું છે, જેનો ઉપયોગ ઝડપી કોમર્સ ડિલિવરી અને હેલ્થ કેર માટે ગુરુગ્રામ અને બીજા શહેરોમાં કંપનીની કામગીરી વિસ્તારવા થશે. શ્રેણી એ ભંડોળ માઉન્ટ જૂડી વેન્ચર્સ, વેન્ચર

કેટાલિસ્ટ, વિન્ડરોઝ કેપિટલ અને ટ્રેમિસ કેપિટલના ટેકા સાથે હાંસલ થયું હતું. ફાડ કેપિટલ્સ, મિસાફિટ્સ, સુનકોર્ન વેન્ચર્સ અને અન્ય હાલના રોકાણકારો, કેમિલિ ઓફિસ અને એન્જલ્સ પણ ભંડોળ રાઉન્ડમાં ભાગ લીધો હતો. સ્કાય એકના સ્થાપક અને સીઇઓ અંકિત કુમારે જણાવ્યું હતું કે નવી મૂડી કંપનીને

હેલ્થકેર, ઇ-કોમર્સ અને ઝડપી કોમર્સ ડિલિવરી માટે ગુરુગ્રામ અને અન્ય શહેરમાં તેના છેલ્લા માઇલ નેટવર્કને વિસ્તૃત કરવા મદદ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રના તબક્કે મોદી ૩.૦ સરકાર સાથે કંપની ભારતીય ડ્રોન ક્ષેત્રમાં અવાનારી પુષ્કળ વૃદ્ધિની કલ્પના કરી છે, જે ૨૦૩૦ સુધી ભારતને વૈશ્વિક ડ્રોન કેન્દ્ર બનાવશે.

એનસીએલએટીની એપોલોની નાદારીની અરજ સાંભળવા એનસીએલટીને તાકીદ

પીટીઆઈ

નવી દિલ્હી, તા. ૧૭
ધી નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ એનસીએલટીને એપીએલ એપોલો ટ્યુબની નાદારીની તાકીદ કરી છે.


પરિકલ્પના અનુસાર

અર્થઘટન કરીને એપીએલ એપોલો ટ્યુબની નાદારી માટેની અરજ કાઢી નાંખવા બદલ બે સભ્યોની એનસીએલટીની બેંગલુરુ બેંચની ઠપકારી હતી. એનસીએલએટીએ જણાવ્યું હતું કે, ટ્રિબ્યુનલે જે વિવાદ સાથે સંકળાયેલ પક્ષકાર છે તેની વાત પોતાના ઉપર ના લેવી જોઈએ. કોઇ અસર કરે તેવા પુરાવા ના હોય તેવા સમયે પોતાના તારણોને ધ્યાનમાં લઇને નિર્ણય

કરવો બરાબર નથી.

એપેલેટ ટ્રિબ્યુનલે એનસીએલટીને નિર્દેશ આપ્યો હતો કે, તાકીદના ધોરણે કાર્યવાહી હાથ ધરવા માટે બનતા પ્રયાસો કરવામાં આવે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, એનસીએલએટી સમક્ષ એપીએલ એપોલો ટ્યુબે એનસીએલટીના આદેશ સામે દાદ માંગી હતી. જે સપ્ટેમ્બર ૯, ૨૦૧૯ના રોજ તેની નાદારી માટેની દાદ નકારી કાઢવામાં આવી હતી.

એપેલેટ ટ્રિબ્યુનલે અંગેના કેસમાં જણાવ્યું હતું કે, એનસીએલટીએ પરિકલ્પના આધારીત અર્થઘટન કર્યું છે. એનસીએલએટીએ એનસીએલટીના આદેશને રદ કરતા જણાવ્યું હતું કે, ટ્રિબ્યુનલ વેધાનિક જોગવાઇથી સ્થાપવામાં આવી છે. તેનું કામ પક્ષકારો વચ્ચે એડજુડિકેટિંગ કરવાનું છે. તેમના તારણો સંબંધીતોઓ કરેલી રજૂઆતો અને પુરાવાઓ પર જ આધારીત હોવા જોઈએ.

**बैंक ऑफ बड़ौदा**
Bank of Baroda

અચલ મિલકત હેઠળની મિલકતો માટે વેચાણ નોટીસ
“APPENDIX- IV-A [See proviso to Rule 6 (2) & 8 (6)]

ઈ- હરાજીની વેચાણ નોટીસ

નાણાંકીય અસ્થાયીતાના સીઝ્યુરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સીઝ્યુરીટી ઇન્ટેરેસ્ટ (સરકેસી)એટ, ૨૦૦૨ ના અમલીકરણ હેઠળ અચલ મિલકતોના વેચાણ માટે ઈ- હરાજીની વેચાણ નોટીસ, નિયમ-૬ (૨) અને ૮(૬) ની સામીતી સાથે વાંચો સુરક્ષા વ્યાજ (અમલ) નિયમો ૨૦૦૨


આથી જાહેર જનતા ને નોટીસ આપવામાં આવે છે કે અને ખાસ કરીને દેવાદાર અને ગેરંટી આપનારને જણાવે છે કે નીચે આપેલ અચલ મિલકતોનું વર્ણન કરાયેલ મોર્ગેજ / સુરક્ષીત લહેવાદારને ચાર્જ કરવામાં આવે છે. બેંક ઓફ બરોડાના અધિકૃત અધિકારી એ નીચે આપેલ સુરક્ષીત સંપત્તિનો કબજો લીધો છે. સુરક્ષીત કેડીટર નીચે પ્રમાણેની વિગત મુજબ બેંકની બાકી વસુલાત માટે જેવી છે જ્યાં છે ના ધોરણે, જેમ છે તે છે અને જે પણ છે તે મુજબ વેચવામાં આવશે. દેવાદાર / ગેરંટર / સુરક્ષીત સંપત્તિ / બાકી / અનામત કિંમત / ઇ-હરાજીની તારીખ અને સમય, ઇએમકીની વિગતો અને બોલી વધારાની રકમ નીચે જણાવેલ છે.

ઈ-હરાજીની તારીખ અને સમય ૦૫-૦૬-૨૦૨૪. બપોરે ૦૨ -૦૦ થી સાંજે ૦૬-૦૦		મિલકત નિરીક્ષણની તારીખ અને સમય ૨૮-૦૬-૨૦૨૪ બપોરે ૦૩.૦૦ થી સાંજે ૦૫.૦૦	પડેશનની સ્થિતિ : ફીક્ષીકલ
અનુ/ લોટ નં.	દેવાદાર / ગેરંટર્સ મોર્ગેજર ના નામ અને સરનામું	અલિ મિલકતનું દંધ વર્ણન અને જો કોઈ બંને જાણમાં હોય તો	કુલ બાકી
૧	શ્રી સંજય વામન શાહવ ફ્લેટ નં. ૪૦૩, ચોથા માળે, ટાવર જે, એગ્રેઝીન રેસીડન્સી, ભાગ્યલક્ષ્મી ટાઉનશીપની પાછળ, પંચમ વિલા સામે, આજવા રોડ, વડોદરા શાખા : પાણીગેટ મો:૯૬૮૭૬૮૯૧૩૧	૨ બીએચકે, ફ્લેટ જે/ ૪૦૩, ચોથા માળે, એગ્રેઝીન રેસીડન્સી, ભાગ્યલક્ષ્મી ટાઉનશીપની પાછળ, પંચમ વિલાની સામે, બાપોદ, આજવા મેઈન રોડ, વડોદરા. રહેણાંક ફ્લેટ નો સર્વે નંબર /પ્લોટ નંબર રે.સ. ૩૬૭ પેકી મિલ્ડઅપ એરીયા ૬૦.૭૪ સ્કે. મીટર અને અવિભાજ્ય એરીયા (સરખાવાને) ૪૨.૬૫ સ્કે.મીટર છે. જેની ચતુર્સીમા : પૂર્વ: ફ્લેટ નં. જે/ ૪૦૨, પશ્ચિમ:ફ્લેટનં.કે -૪૦૨ નોમાર્જીન, ઉત્તર: ફ્લેટનં.કે -૪૦૪ , દક્ષિણ: માર્જીન અને ૨૪ મી. રોડ	શ્રી. ૧૫૯૩૪૭૬.૧૪/- ૨. ડીમાન્ડ નોટીસમાં ઉલ્લેખીત અન્ય ચાર્જ ડીમાન્ડ નોટીસની તારીખ પછી પ્રાપ્ત થયેલી વસુલાત બાદ શ્રી. ૧૩૫૯૦૦૦ શ્રી. ૧૩૫૯૦૦ શ્રી. ૧૦૦૦૦

વેચાણની વિગતવાર શરતો અને નિયમો માટે કૃપા કરીને <https://www.bankofbaroda.in/e-auction.htm> and <https://ibapi.in>. અંદરની લીંકનો સંદર્ભ તો, સંભવીત બોલી લગાવનાર અધિકૃત અધિકારી / શાખા હેડ નો ઉપર મોબાઈલ નંબર આપેલ છે.

અક્ષ લેનાર / જામીનદાર / મોર્ગેજર ને વૈયાનીક ૧૫ દિવસની વેચાણ સુચના ઉપરોક્ત ઉધાર લેનાર / ગીરો / જામીન આપનારને આથી સુરક્ષાહીત(અમલીકરણ) નિયમો ૨૦૦૨ ના નિયમો ૮(૫), ૮(૬) અને ૯(૧)ની જોગવાઈ હેઠળ નોંધવામાં આવે છે.

તારીખ : ૧૭-૦૬-૨૦૨૪ રજીયન : વડોદરા અધિકૃત અધિકારી, બેંક ઓફ બરોડા, વડોદરા



(This is only an advertisement for information purpose and not a prospectus announcement.)

WINNY

WINNY IMMIGRATION & EDUCATION SERVICES LIMITED

CIN: U93000GJ2008PLC054150

Our Company was originally incorporated as 'Winny Immigration & Education Services Private Limited' as Private Limited Company under the provisions of Companies Act, 1956 vide Certificate of Incorporation dated June 09, 2008 bearing Corporate Identification Number U93000GJ2008PTC054150 issued by the Registrar of Companies, Gujarat, Dadra and Nagar Haveli. Further, our Company was converted in to a public limited Company pursuant to a special resolution passed by our shareholders at the EGM held on November 07, 2023 and consequently the name of our Company was changed to 'Winny Immigration & Education Services Private Limited' and a fresh certificate of incorporation was issued by the Registrar of Companies, Ahmedabad dated November 08, 2023. The CIN of the Company is U93000GJ2008PLC054150. For further details, please refer the chapter titled "History and Certain Corporate Matters" beginning on page 97 of Prospectus.

Registered office: 103-104, ATP Arcade, Above Mr. Bean's Coffee Shop, Nr. National Handloom House, Law Garden, Ahmedabad, Gujarat, India, 380006
Tel No.: 079-61906190; | **Website:** www.winnyimmigration.com; | **E-Mail:** compliance@winnyimmigration.com
Contact Person: Ishita Shah, Company Secretary and Compliance Officer

OUR PROMOTER : JIGNESH PATEL

THE OFFER

INITIAL PUBLIC ISSUE OF 6,52,000 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10/- EACH OF WINNY IMMIGRATION & EDUCATION SERVICES LIMITED ("WINNY" OR THE "COMPANY" OR THE "ISSUER") FOR CASH AT A PRICE OF ₹ 140 PER EQUITY SHARE INCLUDING A SHARE PREMIUM OF ₹ 130 PER EQUITY SHARE (THE "ISSUE PRICE") AGGREGATING TO ₹ 912.80 LAKHS ("THE ISSUE"), OF WHICH 34,000 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10/- EACH FOR CASH AT A PRICE OF ₹ 140 PER EQUITY SHARE INCLUDING A SHARE PREMIUM OF ₹ 130 PER EQUITY SHARE AGGREGATING TO ₹ 47.60 LAKHS WILL BE RESERVED FOR SUBSCRIPTION BY MARKET MAKER TO THE ISSUE (THE "MARKET MAKER RESERVATION PORTION"). THE ISSUE LESS THE MARKET MAKER RESERVATION PORTION I.e., NET ISSUE OF 6,18,000 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10/- EACH AT A PRICE OF ₹ 140 PER EQUITY SHARE AGGREGATING TO 865.20 LAKHS IS HEREIN AFTER REFERRED TO AS THE "NET ISSUE". THE ISSUE AND THE NET ISSUE WILL CONSTITUTE 30.05% AND 28.48% RESPECTIVELY OF THE POST ISSUE PAID UP EQUITY SHARE CAPITAL OF OUR COMPANY. FOR FURTHER DETAILS, PLEASE REFER TO SECTION TITLED "TERMS OF THE ISSUE" BEGINNING ON PAGE NO. 172 OF PROSPECTUS.

CORRIGENDUM

- In the Designated market maker of the "Issue related terms" on page no. 4 of prospectus, under the chapter titled "Definitions and Abbreviations" kindly read [●] as *Aftertrade Broking Private Limited (Formerly Known as RCSPL Share Broking Private Limited)*.
- In the Risk Factor No. 05 of "External Risk Factor" on page no. 32 of prospectus, under the chapter titled "Risk Factors" kindly read *Aftertrade Broking Private Limited (Formerly Known as RCSPL Share Broking Private Limited) as Designated Market Maker instead of Beeline Broking Limited.*
- In the Annexure-5, "Restated Statement of Share Capital" on page no. 126 of prospectus, under the chapter titled "Financial Information" kindly read the points (a) and (b) as below:
(a) Authorised Capital - 21,70,000 Equity Shares (Previous Year 50,000) of Rs. 10/- each.
(b) Issued, Subscribed & Fully Paid up Capital 15,18,000 Equity Shares (Previous Year 33,000) of Rs. 10/- each Fully Paid up.
- In the Annexure-5, "Restated Statement of Share Capital" on page no. 126 of prospectus, under the chapter titled "Financial Information" kindly read the Table under point (A) "Reconciliation of the number of Equity shares and amount outstanding at the beginning and at the end of the reporting Period" as below:

Particulars	31st March, 2024	
	No. of Shares	Rs.
At the beginning of the year	33,000	3,30,000
Bonus Issued During the Year	14,85,000	1,48,50,000
	15,18,000	1,51,80,000
Deduction During the year	-	-
At the end of the year	15,18,000	1,51,80,000

This is with reference to Prospectus dated June 12, 2024 filed with Registrar of Companies, Ahmedabad ("ROC"), SME Platform (NSE Emerge) of National Stock Exchange of India (NSE) and Securities and Exchange Board of India ("SEBI") in relation to the Issue. All capitalized term used in this notice (corrigendum/ newspaper advertisement) shall, unless the context otherwise requires, has the meaning ascribed in the prospectus.

INVESTOR MAY PLEASE NOTE THE PROSPECTUS SHALL BE READ IN CONJUNCTION WITH THIS CORRIGENDUM.

PROPOSED LISTING


The Equity Shares offered through the Prospectus are proposed to be listed on the SME Platform of National Stock Exchange of India Limited ("NSE Emerge"). In terms of the Chapter IX of the SEBI (ICDR) Regulations, 2018, as amended from time to time. Our Company has received an In Principal Approval Letter dated May 27, 2024 from National Stock Exchange of India Limited (NSE) for using its name in this offer document for listing of our shares on the SME Platform of National Stock Exchange of India Limited. For the purpose of this Issue, the designated Stock Exchange will be the National Stock Exchange of India Limited ("NSE").


DISCLAIMER CLAUSE OF SECURITIES AND EXCHANGE BOARD OF INDIA ("SEBI")


Since the Issue is being made in terms of Chapter IX of the SEBI (ICDR) Regulations, 2018, the Offer Document was not filed with SEBI. In terms of the SEBI ICDR Regulations, SEBI shall not Issue any observations on the Offer Document. Hence, there is no such specific disclaimer clause of SEBI. However, investors may refer to the entire "SEBI Disclaimer Clause" on page 165 of the Prospectus.

DISCLAIMER CLAUSE OF NATIONAL STOCK EXCHANGE OF INDIA LIMITED (DESIGNATED STOCK EXCHANGE)

"It is to be distinctly understood that the permission given by NSE should not in any way be deemed or construed that the Offer Document has been cleared or approved by NSE nor does it certify the correctness or completeness of any of the contents of the Offer Document. The investors are advised to refer to the Offer Document for the full text of the 'Disclaimer Clause of the NSE' on page 165 of the Prospectus."

LEAD MANAGER OF THE ISSUE
**INTERACTIVE FINANCIAL SERVICES LIMITED**
Address: Office No. 508, Fifth Floor, Priviera, Nehru Nagar, Ahmedabad- 380015, Gujarat, India.
Tel No.: 079 4908 8019
(M) +91-9898055647
Web Site: www.ifinservices.in
Email: mbd@ifinservices.in
Investor Grievance Email: info@ifinservices.in
Contact Person: Pradip Sandhir
SEBI Reg. No.: INM000012856

REGISTRAR TO THE ISSUE
**BIGSHARE SERVICES PRIVATE LIMITED**
Address: Office No. S6-2, 6th Floor, Pinnacle Business Park, Next to Ahura Centre, Mahakali Caves Road, Andheri (East), Mumbai - 400093
Tel No.: +91 22-62638200
Fax No.: +91 22-62638299
Website: www.bigshareonline.com
E-Mail: ipo@bigshareonline.com
Investor Grievance Email: investor@bigshareonline.com
Contact Person: Mr. Sagar Pathare
SEBI Reg. No.: INR000001385

COMPLIANCE OFFICER OF THE ISSUER
**WINNY**
Company Secretary and Compliance Officer
Winny Immigration & Education Services Limited
Address: 104, ATP Arcade, Above Mr Bean's Coffee Shop, Nr. National Handloom House, Law Garden, Ahmedabad, Gujarat, India, 380006
Tel No.: +91 079-61906190;
Website: www.winnyimmigration.com;
E-mail: compliance@winnyimmigration.com

Investors can contact our Company Secretary and Compliance Officer, the Lead Manager or the Registrar to the Issue, in case of any pre-issue or post-issue related problems, such as non-receipt of letters of allotment, non-credit of allotted Equity Shares in the respective beneficiary account, non-receipt of refund orders and non-receipt of funds by electronic mode etc.


WINNY IMMIGRATION & EDUCATION SERVICES LIMITED
On behalf of the Board of Directors
Sd/-
Jignesh Patel
Managing Director (DIN: 02164954)

Date: June 18, 2024
Place: Ahmedabad

WINNY IMMIGRATION & EDUCATION SERVICES LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an Initial Public Issue of its Equity Shares and has filed the Prospectus with the Registrar of Companies, Ahmedabad, Gujarat. The Prospectus is available on the website of SEBI at www.sebi.gov.in, the website of the Lead Manager at www.ifinservices.in, website of the National Stock Exchange of India Limited at www.nseindia.com and website of Issuer Company at www.winnyimmigration.com.

Potential Investors should note that investment in Equity Shares involves a high degree of risk. For details, investors should refer to and rely on the Prospectus including the section titled "Risk Factors" beginning on page no. 18 of the Prospectus. The Equity Shares have not been and will not be registered under the US Securities Act (the "Securities Act") or any state securities law in United States and will not be issued or sold within the United States or to, or for the account or benefit of "U.S. persons" (as defined in the Regulations under the Securities Act), except pursuant to an exemption from, or in a transaction not subject to the registration requirements of the Securities Act of 1933.

garima advt.

**TATA ELXSI LIMITED**
CIN : L85110KA1989PLC009968
Registered & Corporate Office: Tata Elxsi Limited, ITPB Road, Whitefield, Bengaluru-560 048.
Tel: +91 80 2297 9123. E-mail: investors@tataelxsi.com | Website: www.tataelxsi.com

NOTICE OF 35TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING INFORMATION

Notice is hereby given that the 35th Annual General Meeting ("AGM") of Tata Elxsi Limited will be held on **Wednesday, July 10, 2024, at 11:00 a.m. (IST)**, through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM") to transact the business as set out in the Notice to the AGM.

The Securities and Exchange Board of India ("SEBI"), vide its Circular No. SEBI/HO/CFD/ CFD-PoD-2/P/CIR/ 2023/ 167 dated October 07, 2023, has dispensed the requirement of dispatch of physical copies of the Annual Report and Notice of the Meetings to the Shareholders. Accordingly, the Notice of the 35th AGM along with the Integrated Annual Report for FY 2023-24 has been sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Link Intime India Pvt. Ltd./Depositories. The electronic dispatch of the Annual Report has been completed on Saturday, June 15, 2024. The Notice to 35th AGM and the Integrated Annual Report for FY 2023-24 are also available on the Company's website: www.tataelxsi.com, websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of NSDL: <https://www.evoting.nsdl.com>.

The Board of Directors at their meeting held on April 23, 2024, have recommended a final dividend of ₹70/- per equity share on face value of ₹10/- each, for the approval of shareholders at the 35th AGM.

Closure of Register of Members:
Pursuant to Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members of the Company will remain closed from Wednesday, June 26, 2024 to Wednesday, July 10, 2024 (both dates inclusive) for the purpose of 35th AGM and to determine the Members eligible to receive the dividend for the financial year ended March 31, 2024.

Manner of registration of e-mail address:
Shareholders may register their e-mail address or PAN, if not registered with the Depositories (for shares held in electronic form) / Company's Registrar (for shares held in physical form), on or before **05:00 p.m. IST on Wednesday, June 26, 2024** to receive the Notice to the AGM along with Annual Report for FY 2023-24, by visiting the link https://liiplweb.linkintime.co.in/EmailReg/Email_Register.html and updating the requested details against the Company's name.

Manner of casting vote through e-voting:
The Members are provided with a facility to cast their vote electronically on all resolutions set forth in the Notice to 35th AGM using the e-voting system provided by NSDL. The remote e-voting period commences on **Saturday, July 6, 2024, at 09:00 a.m. (IST)** and ends on **Tuesday, July 09, 2024, at 05:00 p.m. (IST)**. During this period, Members holding shares either physical or in dematerialised form as on the **cut-off date, Wednesday, July 03, 2024** may cast their vote electronically. The instructions on remote e-voting are detailed in the notes to the Notice convening the AGM, and is also available at www.evoting.nsdl.com.

Members who would like to express their views or ask questions during the AGM may register themselves as a speaker by sending their request from their registered e-mail address mentioning their name, DP ID and Client ID/ folio number, PAN, mobile number at tagm@tataelxsi.com between **Monday, July 01, 2024 (09:00 a.m. IST) to Wednesday, July 03, 2024 (06:00 p.m. IST)**. The facility to express views/ask questions during the AGM shall be restricted only to those members who have pre-registered themselves as a speaker. The Company reserves the right to restrict the number of speakers depending on the availability of time for the AGM.

Deduction of Tax at source for dividend:
Pursuant to the Finance Act, 2020, dividend income will be taxable in the hands of shareholders w.e.f. April 01, 2020, and the Company is required to deduct tax at source from dividend paid to shareholders at the prescribed rates.

A Resident Individual Shareholder with PAN and who is not liable to pay Income Tax may submit a yearly declaration in Form No. 15G/15H, to avail the benefit of non-deduction of tax at source. Copies of the forms are accessible at <https://www.tataelxsi.com/investors/corporate-announcements> and may be directly filled in and shared via e-mail to csge exemptions2425@linkintime.co.in by **06.00 p.m. (IST), Wednesday, June 26, 2024**. Members are requested to note that in case their PAN is not registered, the tax will be deducted at a higher rate.

Non-resident shareholders can avail beneficial rates under the tax treaty between India and their country of residence, subject to providing necessary documents, i.e. No Permanent Establishment and Beneficial Ownership Declaration, Tax Residency Certificate, Form 10F, any other document which may be required to avail the tax treaty benefits by sending an e-mail to nri exemptions@tataelxsi.com. The aforesaid declarations and documents are required to be submitted by the Members by **06.00 p.m. (IST), Wednesday, June 26, 2024**.

For any clarifications and assistance, Members may write to csq-unit@tclplndia.co.in or investors@tataelxsi.com.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call at **022 - 4886 7000 / 2499 7000** or send a request at evoting@nsdl.co.in.

for **TATA ELXSI LIMITED**
Sd/-
(CAUVERI SRIRAM)
Company Secretary & Compliance Officer

Place : Bengaluru
Dated : June 17, 2024